

ઉમેદવારો જોગ અગત્યની જાહેરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ધ્વારા નીચેના સંવર્ગોના ફાઇનલ સીલેક્શન અને રેકમન્ડેશન લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની નકલ પંચાયત વિભાગની વેબસાઇટ <https://panchayat.gujarat.gov.in> ઉપર મુકવામાં આવેલ છે. આ ફાઇનલ સીલેક્શન અને રેકમન્ડેશન લીસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા ૧૭-૪-૨૦૧૨ ના નોટીફિકેશન નં.કેપી/૧૧/૨૦૧૨/પીઆરઆર/૧૦૨૦૦૯/૧૯૭૬/ ડી થી પ્રસિધ્ધ કરવામાં આવેલ ગુજરાત પંચાયત સેવા (વર્ગ-૩) ભરતી (પરીક્ષા) નિયમો-૨૦૧૨ના નિયમ-૧૧ની જોગવાઈ અન્વયે રૂબરૂ ઓનસ્ક્રીન જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં નીચેની વિગતે જે તે તારીખ-સમયે બોર્ડની કચેરીએ અચુક હાજર રહેવા જણાવવામાં આવે છે. આ અંગે ઉમેદવારોના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર SMS થી જાણ કરવામાં આવેલ છે. તેમજ તેમના રજીસ્ટર્ડ ઇ-મેઇલ ઉપર પણ આ બાબતે જાણ કરવામાં આવેલ છે. આમ છતાં કોઇ પણ સંજોગોમાં જાણ ન થાય તો પણ ઉમેદવારે નીચે દર્શાવેલ તારીખ અને સમયે અચુક હાજર રહેવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી. વધું વિગતો માટે પંચાયત વિભાગની વેબસાઇટ ઉપર જોવા વિનંતી છે.

જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ	ફાઇનલ સીલેક્શન અને રેકમન્ડેશન યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમની તારીખ અને સમય		ફાઇનલ સીલેક્શન અને રેકમન્ડેશન યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોના યાદી અનુક્રમ નંબર (SR.NO)
	તારીખ	સમય	
૩/૨૦૧૮-૧૯, સ્ટાફ નર્સ	૧૩/૨/૨૦૧૯	સવારે ૯:૦૦ કલાકે	SR. NO. ૧ થી ૧૫૦
	૧૩/૨/૨૦૧૯	સવારે ૧૦:૩૦ કલાકે	SR. NO. ૧૫૧ થી ૨૮૫
૬/૨૦૧૮-૧૯, નાયબ ચીટનીશ	૧૩/૨/૨૦૧૯	બપોરે ૧૪:૦૦ કલાકે	ફાઇનલ સિલેક્ટ લીસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારો
૫/૨૦૧૮-૧૯, વિસ્તરણ અધિકારી (ખેતી)	૧૩/૨/૨૦૧૯	બપોરે ૧૫:૦૦ કલાકે	
૯/૨૦૧૮-૧૯, સંશોધન મદદનીશ	૧૩/૨/૨૦૧૯	બપોરે ૧૫:૦૦ કલાકે	
૪/૨૦૧૮-૧૯, સમાજ કલ્યાણ નિરીક્ષક	૧૩/૨/૨૦૧૯	બપોરે ૧૫:૦૦ કલાકે	
૮/૨૦૧૮-૧૯, વિસ્તરણ અધિકારી (સહકાર)	૧૩/૨/૨૦૧૯	બપોરે ૧૬:૦૦ કલાકે	
૧/૨૦૧૮-૧૯, મુખ્ય સેવિકા	૧૪/૨/૨૦૧૯	સવારે ૯:૦૦ કલાકે	SR. NO. ૧ થી ૨૦૦
	૧૪/૨/૨૦૧૯	બપોરે ૧૨:૦૦ કલાકે	SR. NO. ૨૦૧ થી ૩૦૦
	૧૪/૨/૨૦૧૯	બપોરે ૨:૩૦ કલાકે	SR. NO. ૩૦૧ થી ૫૨૧

સુચના:-

- (૧) ઉમેદવારે જાતેનિયત તારીખ- સમયે હાજર રહેવાનું રહેશે. અને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- (૨) ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રો તથા ફોટો આઇડી પુઝ અને કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે લાવવાનો રહેશે.
- (૩) ઉમેદવારોને ઓનસ્ક્રીન જિલ્લા ફાળવણી મેરીટ ક્રમાંકના સીલેક્શન કેટેગરી મુજબ ઉપલબ્ધ જિલ્લાવાર જગ્યા અનુસાર કરવામાં આવશે. ઓનસ્ક્રીન જિલ્લા ફાળવણી માટે જ્યારે ઉમેદવારનો ક્રમ આવે ત્યારે તે સમયે ઉમેદવાર/ તેઓના ઓથોરાઇઝ પ્રતિનિધિ ફરજિયાત પણે હાજર હોવા જોઇએ, અને જો તે સમયે કોઇ ઉમેદવાર/ ઓથોરાઇઝ પ્રતિનિધિ હાજર રહેશે નહિ તો, તેવા ઉમેદવારે પોતાની ઉમેદવારી કાયમી પણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ ગ્રાહ્ય રખાશે નહિ.
- (૪) કોઇ કારણસર સંબંધિત ઉમેદવાર જાતે હાજર રહી શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં એફીડેવીટ ઉપર ઓથોરીટી લેટર સાથે અધિકૃત કરેલ વ્યક્તિને હાજર રાખી શકશે. સદર ઓથોરીટી લેટર ઉપર ઉમેદવારનો અને જેને અધિકાર આપેલ છે તે વ્યક્તિનો ફોટો ચોટાડેલ હોવો જોઇએ અને સદર બંને ફોટા ઉપર સંબંધિત ઉમેદવારે સહી કરેલ હોવી જોઇએ. સદર અધિકૃત કરેલ વ્યક્તિ ધ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સંબંધિત ઉમેદવારને બંધનકર્તા રહેશે. અધિકૃત કરેલ વ્યક્તિએ પોતાના ઓળખપત્રની અસલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવી. ઓથોરીટી લેટર એફીડેવીટ સ્વરૂપે હોવો જોઇશે.
- (૫) ઉમેદવાર પોતે નિયત તારીખ અને નિયત સમયે હાજર ન રહે અથવા જિલ્લા પસંદ ન કરે અથવા પસંદ કરવાનો ઇન્કાર કરે તેવા કિસ્સામાં બોર્ડનો નિર્ણય આખરી રહેશે અને ત્યારપછી આ બાબતે કોઇ પણ દાવો/વિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

સ્થળ:- ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની કચેરી,

બ્લોક નં.૨, પાંચમો માળ,

કર્મચોગી ભવન, ડી વીંગ સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

તારીખ:- ૦૮/૨/૨૦૧૯

સચિવ

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ,